

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી :-

પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોનીયર્સ, એકોલોન્સ ચિલ્ડ્રન ક્લબ અને જીનિયસ ગ્રુપ દ્વારા સાઈકલોકીડ અને સાઈકલોથોન યોજાઈ

તારીખ: ૨૦-૦૧-૨૦૨૦



Inauguration of 26th January Celebration



પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ ની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં કરવામાં આવે છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ: ૧૯-૦૧-૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ રેન્ડોનીયર્સ, એકોલોન્સ ચિલ્ડ્રન ક્લબ અને જીનિયસ ગ્રુપ વિગેરેના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે સાઈકલોકીડ

અને સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ કી.મી. ની સાઈકલોકીડમાં અંદાજે કુલ ૨૦૦૦ બાળકો અને ૨૫ કી.મી. ની સાઈકલોથોનમાં અંદાજે ૪૦૦ જેટલા વયસ્કોએ ભાગ લીધો હતો. આ સાથે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી પણ સાઈકલોથોનમાં ભાગ લોધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, ડે. મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, નાયબ મ્યુનિ, કમિશનરશ્રી ચેતન નંદાણી, ચેરમેન જીનિયસ ગુપ શ્રી ડી.વી. મહેતા, ઇવેન્ટ કો-ઓર્ડિનેટર શ્રી પરેશભાઈ બાબરીયા, શ્રી પરાગભાઈ તન્ના, શ્રી શ્રીકાંતભાઈ તન્ના અને શ્રી વિજયભાઈ ઠોંગા ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, આપણું શહેર માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની એક નવી ઈમેજ રચવા આગળ ધપી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના ભૌતિક વિકાસની સાથોસાથ સામાજિક, રચનાત્મક અને પર્યાવરણ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રાજકોટને શ્રેષ્ઠ શહેર બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે સાઈકલોથોન યોજવામાં આવેલ છે, તે બદલ તમામ સંસ્થાને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ ની ઉજવણી નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાજકોટની રંગીલી જનતા માટે રાખવામાં આવ્યો છે, રાજકોટવાસીઓનો આ ઉત્સાહ જોઈને એમ કહી શકાય કે, રાજકોટ ખરેખર રંગીલું શહેર છે. રાજકોટ મહાનગરપાલિકા વિકાસની સાથોસાથ રચનાત્મક પ્રવૃત્તિઓ પણ હાથ ધરીને રાજકોટની એક નવી ઓળખ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સાઈકલનો ઉપયોગ કરવાથી શરીરને અને પર્યાવરણને ખુબ જ ફાયદા થાય છે, આમ પણ સાઈકલીંગ વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે.

આ કાર્યક્રમ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે સવારે ૦૬:૦૦ કલાકે યોજવામાં આવ્યો હતો, જેનું ફ્લેગ ઓફ ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક

પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગણી અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

સાયકલોકીડ અને સાઈકલોથોનમાં બે કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં એક કેટેગરીમાં ૮ થી ૧૨ વર્ષના બાળકો માટે ૧૨ કિ.મી. ની રાખવામાં આવી હતી, જ્યારે બીજી કેટેગરીમાં વયસ્કો માટે ૨૫ કિ.મી.ની સાયકલોથોન રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત તમામ ભાગ લેનાર સ્પર્ધકને એનર્જી માટે નાસ્તો, જ્યુસ અને ચોકલેટ પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે સાઈકલોકીડમાં ભાગ લેનાર સ્પર્ધકોના લક્કી ડ્રો કરી ૧૫ લક્કી સ્પર્ધકોને સાઈકલ આપવામાં આવી હતી અને ૧૫૦ જેટલા સ્પર્ધકોને ગીફ્ટ પુરસ્કાર પણ આપવામાં આવી હતી.

(જન સંપર્ક અધિકારી)